

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૫/૦૨/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૫ કેસ કરી, ૫૬ વ્યક્તિઓને ઝડપી, ૩૬૩ લીટર દેશી દારૂ, ૬૨૮ બોટલ ઈંગ્લીશ દારૂ, ૬૯૦ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, ૦૧ સ્કૂટર, ૦૧ કાર અને ૦૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૮૬૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ ચોરી:-

સમાચાર યાદી નં.૨૪૮/૧૮

વટવા : જ્યંતિભાઈ ઇશ્વરભાઈ પ્રજાપતિ (ઉ.વ.૫૮)(રહે,વલ્લભ પાર્ક સોસાયટી, ગેબનશાથી ઘોડાસર કેનાલ રોડ હનુમાનજીના મંદિર પાસે વટવા) એ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૨/૧૮ ના કલાક ૮/૦૦ થી તા.૦૪/૦૨/૧૮ સાંજના ૪/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના બંધ મકાનની જાળી એ મારેલ તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, મકાનમાંથી સોના-ચાંદીના દાગીના કુલ કિંમત રૂપિયા ૫૭,૦૦૦/- મત્તાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ યલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૪૯/૧૮

શાહીબાગ: આરતીબેન દીલીપસિંહ ડાભી (ઉ.વ.૪૪) (રહે.ગામ પલીયડ કલોલ ગાંધીનગર) તા.૦૪/૦૨/૧૮ સવારના ૯/૩૦ થી ૧૦/૧૫ વાગ્યા દરમ્યાન ચાંદખેડા બસ સ્ટેન્ડ થી શટલ ઓટોરિક્ષામાં બેસી સિવિલ ગેટ નંબર-૫ સુધીની મુસાફરી દરમ્યાન અજાણી વ્યક્તિએ રિક્ષામાં આરતીબહેનની નજર ચુકવી શેલામાંથી સોનાની મગમાળા પેડલ સાથે કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- અને સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી લીધી હતી. આ અંગેની ફરીયાદ આરતીબહેન ડાભી એ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.પી.ડાભી યલાવે છે.

રામોલ : સુધીરભાઈ સદાનંદજાધવ (ઉ.વ.૫૩)(રહે,સ્વાતી એપાર્ટમેન્ટ રજવાડુ હોટલ ની સામે જીવરાજ પાર્ક વેજલપુર) એ તા.૦૪/૦૨/૧૮ ના રોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૧૧/૧૭ ના કલાક ૦૯/૩૦ થી ૧૦/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન વેજલપુર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ થી બસ માં બેસી, બરોડા એક્સપ્રેસ હાઇવે બસ સ્ટેન્ડ સુધીની મુસાફરી દરમ્યાન બીડ માં કોઈ અજાણી વ્યક્તિએ બીડ નો લાભ લઈ, સુધીરભાઈની નજર ચુકવી, તેઓની બેગ માંથી રોકડા રૂપિયા ૫૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી અનીલભાઈ દેવજીભાઈ ચલાવે છે.

સોનાની ચેઇન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૫૦/૧૮

ચાંદખેડા: કાંતીદેવી ધર્મરાજ કુમાર (ઉ.વ.૫૮) (રહે. સ્વાતી રેસીડેન્સી વિભાગ-૦૪ સ્નેહપ્લાઝા રોડ, ચાંદખેડા) તા.૦૨/૦૨/૧૮ બપોરના ૨/૧૫ વાગ્યાના સુમારે સ્વાતી રેસીડેન્સી વિભાગ-૦૪ ના ગેટની સામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ કાંતીદેવી ના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૭,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ કાંતીદેવી કુમારે તા.૪/૨/૧૮ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.કે.રાઠવા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૫૧/૧૮

નારોલ : હુશેનભાઈ અબ્દુલભાઈ મીર (ઉ.વ.૪૪)(રહે,બરફની ફેક્ટરી ગુડલક હોટલની સામે કાચા છાપરમાં વિશાલા) એ તા.૪/૨/૧૮ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૧/૧૮ ના કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે હુસેનભાઈના બહેન ફાતમાબેન યાફુબભાઈ મીર (ઉ.વ.૬૫) વિશાલા નારોલ હાઇવે કોઝી હોટલ સામે રોડ ક્રોસ કરતા હતા દરમ્યાન વિશાલા તરફથી એક અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે ટક્કર મારી નીચે પાડી દેતા, જમણા પગે તથા શરીરે ઇજાઓ થતાં, સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૪/૦૨/૧૮ ના કલાક ૬/૪૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતુઆ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ઝેડ.આઇ.શેખ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૫૨/૧૮

મેઘાણીનગર: નરેશભાઈ પરષોતમભાઈ શ્રીમાળી (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ મેઘાણીનગર) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૨/૧૮ રાતના ૧૦/૦૦ થી ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી સુરજીભાઈ નાનજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.